

ચોઇસ ભરવા માટેની સૂચના

- જે ઉમેદવાર પાસે એ.સી.પી.સી.(ACPC) ધ્વારા આપવા માં આવેલ મેરીટ નંબર હશે તે જ ઉમેદવાર એ.સી.પી.સી ધ્વારા જાહેર કરેલી સમય મર્યાદા માં ચોઇસ ફિલિંગ કરી શકશે.
- ઉમેદવારે પોતાના મેરીટ ક્રમાંક ને ધ્યાને રાખીને પોતાની પસંદગી ની સંસ્થા ને અગ્રતા ક્રમ માં ગોઠવી ને મહત્તમ સંખ્યા માં ચોઇસ ભરવા ની સલાહ આપવામાં આવે છે.
- દરેક ઉમેદવાર ને ચોઇસ ફિલિંગ કરતાં પેહલા વેબ સાઇટ <http://www.jacpcldce.ac.in/> પરથી **સીટ મેટ્રિક્સ** તથા **સંસ્થા ની યાદી** જોવાની ભલામણ કરવામાં આવે છે
- **સીટ મેટ્રિક્સ**માંથી ઉમેદવાર પોતાની કેટેગરી અને સબ કેટેગરી માટે ઉપલબ્ધ બેઠક ની સંખ્યા મેળવી શકે છે. ઉમેદવાર ને જે તે સંસ્થા ની TFW બેઠકો ની માહિતી પણ ઉપરોક્ત વેબ-સાઇટ પર થી મેળવી શકે છે.
- **સંસ્થાની યાદી** માં થી ઉમેદવાર અભ્યાસક્રમ(એમબીએ / એમસીએ), સંસ્થા કોડ સંસ્થાનું સરનામું, બેઠકો ની સંખ્યા અને સંસ્થા ની ફી (વર્ષ-૨૦૧૯ પ્રમાણે) મેળવી શકે છે.
- બે અલગ અલગ મેરિટ લિસ્ટ દરેક અભ્યાસક્રમ પ્રમાણે જાહેર કરવા માં આવશે. દરેક અભ્યાસક્રમ(એમબીએ અથવા એમસીએ) માટે, એક મેરિટ લિસ્ટ માટે ગુજરાત રાજ્યના ક્વોટા માટે છે અને બીજું મેરિટ લિસ્ટ એ ALL INDIA ક્વોટા (ગુજરાત રાજ્ય સિવાય ના) માટે આપવા માં આવશે.
- એમબીસી (MBC) માટે અરજી કરનાર ઉમેદવાર જો પ્રવેશ ની યોગ્યતા ધરાવતો હોય તો તે ઉમેદવાર ને બંને એમબીએ અને એમસીએ કોર્સ નો અલગ-અલગ મેરીટ રેંક આપવા માં આવશે. ઉમેદવાર ના મેરીટ ક્રમાંક તથા ભરેલ ચોઇસ ના અગ્રતાક્રમ પ્રમાણે MBA સંસ્થા અથવા MCA સંસ્થા કોઈ એક માત્ર સંસ્થામાં પ્રવેશ ફાળવવા માં આવશે જેની જરૂરી નોંધ લેશે જી.
- ALL INDIA QUOTA (ગુજરાત રાજ્ય સિવાય ના) ના ઉમેદવાર માત્ર સરકારી તથા અનુદાનિત સંસ્થા માં પોતાની ચોઇસ ભરી શકશે.